



પ્રિય પરિવારો,

હેમિલ્ટન-વેન્ટવર્થ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ (HWDSB) ખાતે, અમે અવરોધોને ઓળખવા અને તેમને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છીએ જેથી અમે તમામ વિદ્યાર્થીઓને સહાયક, સમાવિષ્ટ અને આદરપૂર્ણ શિક્ષણનું વાતાવરણ પ્રદાન કરી શકીએ.

અમારા વિદ્યાર્થીઓ વિશે વધુ જાણવા માટે, અમે સ્વૈચ્છિક અને ખાનગી વસ્તી ગણતરી કરીશું. એપ્રિલ 2021 માં, *વી ઓલ કાઉન્ટ: HWDSB વિદ્યાર્થી વસ્તી ગણતરી 2021* ખોલવામાં આવી હતી અને પ્રણાલીગત અવરોધોને ઓળખવા અને સંબોધવા માટે વિદ્યાર્થીઓની ઓળખ (જાતિ, લિંગ, વગેરે) વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. રોગચાળા અને ઓછા પ્રતિસાદ દરને લીધે, અમે તમામ વિદ્યાર્થીઓને વસ્તી ગણતરી પૂર્ણ કરવાની તક પૂરી પાડવા માટે ફરીથી વિદ્યાર્થી વસ્તી ગણતરી શરૂ કરી રહ્યા છીએ. આ 29 નવેમ્બર, 2021 થી 16 ડિસેમ્બર, 2021 સુધી થશે.

ઘણા શાળા બોર્ડે વિદ્યાર્થીની વસ્તી ગણતરી હાથ ધરી છે. વાસ્તવમાં, જાતિવાદ વિરોધી અધિનિયમ, 2017 અને ઓન્ટારિયોના એજ્યુકેશન ઇક્વિટી એક્શન પ્લાન માટે શાળા બોર્ડને આ આંકડા એકત્ર કરવા અને તેની જાણ કરવા જરૂરી છે. HWDSB ના ઇક્વિટી એક્શન પ્લાનમાં પણ તે પ્રાથમિકતાનો પ્રોજેક્ટ છે.

અમે જાણીએ છીએ કે વ્યક્તિની ઓળખ વિશે પૂછવું અસુવિધાજનક હોઈ શકે છે, અને અમે સંવેદનશીલતા સાથે તે કરીશું. અમે વિદ્યાર્થીઓ, પરિવારો, સ્ટાફ અને સમુદાયના સભ્યોની સલાહ લીધી જેથી આ વસ્તી ગણતરી HWDSB ને નિષ્પક્ષતા, વિદ્યાર્થીઓની સિદ્ધિ અને સુખાકારીને સમર્થન આપવા પુરાવાયુક્ત -સુમાહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરે.

તે કેવી રીતે થશે?

કિન્ડરગાર્ટનથી ગ્રેડ 4 ના વિદ્યાર્થીઓ: પેરેન્ટ પોર્ટલમાં એક ફોર્મ ઉમેરવામાં આવશે. માતા-પિતા અને વાલીઓ આ સ્થળે પોર્ટલ પર જઈ, ફોર્મ ખોલી શકે છે અને વિદ્યાર્થી ગણતરી પૂર્ણ કરી શકે છે. પ્રિન્ટ નકલો તમારા બાળકના શિક્ષકને વિનંતી કરવાથી ઉપલબ્ધ હોય છે. કૃપા કરીને વિદ્યાર્થી દીઠ માત્ર એક જ વસ્તી ગણતરી ફોર્મ ભરો (ઓનલાઇન અથવા પ્રિન્ટ).

ગ્રેડ 5 થી 12 - રુબરુમાં અને દૂરસ્થ ભણનાર વિદ્યાર્થીઓ: અમે, ફરી એકવાર, ગ્રેડ 5 થી 12 ના વિદ્યાર્થીઓને એક સુરક્ષિત લિંક ઇમેલ કરીશું, જેથી તેઓ શિક્ષકની મદદ સાથે વર્ગના સમય દરમિયાન વસ્તી ગણતરીનું ફોર્મ ઓનલાઇન પૂર્ણ કરી શકે. જે વિદ્યાર્થીઓના માતા-પિતા/વાલીઓએ અગાઉ વિનંતી કરી હતી કે તેઓ વસ્તી ગણતરીમાં ભાગ નહીં લે, તેઓને ઇમેલ પ્રાપ્ત થશે નહીં.

તેમાં શું પૂછાય છે?

વિદ્યાર્થીની ઉંમરના આધારે, વસ્તી ગણતરી પરના પ્રશ્નોમાં વિદ્યાર્થીની ભાષાઓ, સ્વદેશી ઓળખ, વંશીયતા, જાતિ, ધર્મ, લિંગ ઓળખ, જાતીય અભિગમ, (અ) ક્ષમતાઓ, જન્મ સ્થળ અને નાગરિકતા/ઇમિગ્રેશન સ્થિતિ વિશે પૂછવામાં આવી શકે છે.

HWDSB વિધાર્થીઓની અંગત માહિતીનું રક્ષણ કેવી રીતે કરશે?

HWDSB વિધાર્થીઓ અને પરિવારો વિશે માહિતી એકત્રિત કરતી વખતે ઉચ્ચતમ સ્તરની ગોપનીયતા અને ગુપ્તતા માટે પ્રતિબદ્ધ છે. વિધાર્થી વસ્તી ગણતરીનો ડેટા જાતિવાદ વિરોધી અધિનિયમ, 2017, S.O.ની સત્તા હેઠળ એકત્રિત કરવામાં આવે છે. 2017, સી. 15, શિક્ષણ અધિનિયમ, R.S.O. 1990, c. E.2, અને મ્યુનિસિપલ ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ પ્રોટેક્શન ઓફ પ્રાઇવસી એક્ટ, R.S.O.નું પાલન કરે છે. 1990, c. M.56.

વિધાર્થી વસ્તી ગણતરી ગોપનીય છે, પરંતુ તે અનામી નથી. વ્યક્તિગત વિધાર્થીના પ્રતિભાવોને વિશ્લેષણ માટે એકસાથે જૂથબદ્ધ કરવામાં આવશે જેથી કરીને વિધાર્થીની કોઈપણ વ્યક્તિગત માહિતી ક્યારેય ઓળખી ન શકાય. એકત્રિત પ્રતિસાદો એક સુરક્ષિત, ગોપનીય ડેટાબેઝમાં સંગ્રહિત કરવામાં આવશે અને HWDSB ના વિધાર્થીઓ વચ્ચેના વલણોને ઓળખવા અને સારાંશ આપવા માટે માત્ર અધિકૃત HWDSB રિસર્ચ અને એનાલિટિક્સ સ્ટાફને જ તેની સુલભતા કરવામાં આવશે.

શું તે ફરજિયાત છે?

વસ્તી ગણતરી પૂર્ણ કરવી એ સ્વૈચ્છિક છે. છતાં અમે વિધાર્થીઓને ભાગ લેવા માટે કહીએ છીએ જેથી અમને અમારી વિધાર્થી-વસ્તીનું ચોક્કસ ચિત્ર મળે. ઉચ્ચ પ્રતિભાવ દર અમને અમારા કાર્યક્રમો અને સંસાધનો દ્વારા વિધાર્થીઓની સિદ્ધિ અને સુખાકારીમાં અવરોધો ઓળખવામાં, વ્યૂહરચના બનાવવામાં અને અવરોધોને દૂર કરવામાં મદદ કરશે. જે વિધાર્થીઓએ પહેલાથી જ ભાગ લેવાનો ઇનકાર કરી દીધેલ છે તેઓને જ્યારે તે ફરી ખુલશે ત્યારે સર્વેક્ષણ લિક પ્રાપ્ત થશે નહીં. એ કુટુંબો કે જેઓ તેમના બાળકને ભાગ લેવા દેવા માંગતા નથી અને અગાઉ ભાગ લેવાનો ઇનકાર કરેલ નથી તેઓ research@hwdsb.on.ca પર ઇમેઇલ કરી શકે છે.

પ્રશ્નો?

અમે વસ્તી ગણતરીની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે અમે પ્રશ્નોને આમંત્રિત કરીએ છીએ અને જવાબ આપી રહ્યા છીએ. કૃપા કરીને અમારી વેબસાઇટ www.hwdsb.on.ca/weallcount પર વધુ જાણો, જ્યાં તમને વસ્તી ગણતરી વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) મળશે. તમે અમારી વિધાર્થી વસ્તી ગણતરી ટીમનો census@hwdsb.on.ca પર પણ સંપર્ક કરી શકો છો.

અમે શિક્ષણ પ્રણાલીમાં વધુ ન્યાયપૂર્ણ પરિણામો સર્જી શકીએ તે માટે HWDSB ને જવાબદાર રીતે ડેટા એકત્રિત કરવામાં મદદ કરવા બદલ આપનો આભાર.

ભવદીય,



HWDSB



Manny Figueiredo
සැලැස්තර of Education

Paul Denomme
Superintendent of Student Achievement,
Equity and Student Engagement

curiosity • **creativity** • **possibility**